


Where the growth is guaranteed



**RK** INDUSTRIAL CITY  
ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ

## Who we are?



THE LANDMARK CREATORS

સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનો પાયો નાખનાર- RKGroup અમારો એક જ મંત્ર છે

“લોંગ વિઝન, ઉત્તમ આયોજન, ઝડપી વિકાસ”

અમે અપિરત પ્રયત્ન કરીએ છીએ વિકાસની નવી ક્ષિતિજોને ઓળખવા, સર્વાંગી વિકાસની શક્યતાઓ ચકાસવા, વિઝનરી આયોજન કરવા અને વિકાસ અને વળતર સુનિશ્ચિત કરવા. આટલી કાળજી સાથે અમે આધુનિક યુગના પ્રાઇવેટ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કનું નિર્માણ કરીએ છીએ. આ મંત્ર સાથે અમે સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસનો નકશો બદલી રહ્યા છીએ. એટલે જ તો એન્ત્રોપ્રેન્યોર્સ અને સ્ટાર્ટ-અપ માટે ઉત્સાહી લોકોની અમે પ્રથમ પસંદગી છીએ. અમે નહીં, ઉદ્યોગ જગત કહે છે કે “અત્યાર સુધી જે RK ઈન્ડસ્ટ્રીઅલમાં આવ્યા તે સૌ હંમેશા ફાવ્યા.” આમ, R K Group પોતાના વિઝન અને અનુભવ વડે સૌનો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળ રહ્યું છે.

## One more jewel in the crown



Rajkot Industrial City શાપર- ઝોનમાં વિકાસનો સોનેરી વિકલ્પ

“ઉંચું વળતર, ડબલ ગ્રોથનો વાયદો ચૂકશો નહીં, અડધા ભાવે શાપરનો ફાયદો”

Rajkot Industrial City રાજકોટના ઉદ્યોગથી ઘમઘમતા એવા શાપર ઔદ્યોગિક ઝોનમાં આવેલ નારણકામાં સાકાર થનાર છે. શાપર તો ઉદ્યોગથી ઘમઘમી જ રહ્યું છે અને તેની નજીકમાં લોહડા પણ સુવિકસિત છે. એટલે R K Industrial City ની આસપાસ પણ ઉદ્યોગને અત્યંત સાનુકૂળ માહોલ છે. અહીં મશીનરી, ઓટોમોબાઇલ્સ, ફૂડ, સબમર્સિબલ પમ્પ્સ, જેવી એવરગ્રીન ઈન્ડસ્ટ્રીઝ છે. રાજકોટના બીજા રિંગ રોડથી તદ્દન નજીક એવા આ પ્રોજેક્ટને મળશે પોરબંદર, ભાવનગર, પીપાવાવ પોર્ટ, અમદાવાદ, મોરબી અને મુન્દ્રા જેવા મહત્વના સ્થળોની કનેક્ટિવિટી. રાજકોટના નવા હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટથી પણ નજીક એવું RK Industrial City તમારા માટે ગ્રોથનો ગોલ્ડન ગેઈટ બની રહેશે.

## Our Successful Projects



R.K. INDUSTRIAL ZONE



R.K. INDUSTRIAL HUB



R.K. INDUSTRIAL PARK



R.K. INDUSTRIAL ZONE - 6



R.K. INDUSTRIAL ZONE - 7



R.K. INDUSTRIAL ZONE - 8



R.K. INDUSTRIAL ZONE - 9



R.K. INDUSTRIAL ZONE - 11



R.K. INDUSTRIAL ZONE - 12




R.K. LOGISTIC PARK - 1



## Visionary planning and infrastructure

- RKGroup નો ફર્સ્ટ એડવાન્ટેજ છે તેના દ્વારા સિલેક્ટ થયેલું લોકેશન.
- 550 ચોરસ વારના 159 પ્લોટ્સ ઉપલબ્ધ.
- Phase A અને Phase B ને જોડતો કનેક્ટિંગ રોડ.
- કોમર્શિયલ વ્હીકલ્સની સરળ મૂવમેન્ટ માટે ઇન્ટરનલ સફિશિયન્ટ વાઈડ રોડ્ઝ.





**PHASE-A**

PLOT NO.	PLOT AREA SQ. YD.	PLOT NO.	PLOT AREA SQ. YD.	PLOT NO.	PLOT AREA SQ. YD.
1	833.31	16	590.82	31	987.21
2	358.80	17	803.60	32	967.11
3	358.80	18	803.60	33	1037.63
4	358.80	19	590.82	34	1117.12
5	358.80	20	590.82	35	1185.32
6	358.80	21	590.82	36	2238.34
7	358.80	22	590.82	37	3288.40
8	1059.93	23	681.72	38	780.23
9	636.27	24	968.44	39	817.98
10	636.27	25	821.10	40	4859.41
11	636.27	26	730.12	41	1192.01
12	681.72	27	745.36	42	1060.83
13	590.82	28	1504.07	43	929.66
14	590.82	29	1033.07	44	873.62
15	590.82	30	1017.35		



**PHASE-B**

PLOT NO.	PLOT AREA SQ. YD.	PLOT NO.	PLOT AREA SQ. YD.	PLOT NO.	PLOT AREA SQ. YD.	PLOT NO.	PLOT AREA SQ. YD.	PLOT NO.	PLOT AREA SQ. YD.
1/1	1857.51	21	590.82	44	590.82	67	506.22	90	477.32
1/2	1404.74	22	590.82	45	590.82	68	810.53	91	618.45
1/3	1463.26	23	590.82	46	590.82	69	1076.32	92	757.65
1/4	1993.19	24	590.82	47	590.82	70	1076.40	93	956.74
2	2838.59	25	590.82	48	590.82	71	1076.40	94	1480.54
3	2810.53	26	590.82	49	803.60	72	1076.40	95	1046.50
4	2807.79	27	590.82	50	758.16	73	1181.54	96	1046.50
5	1116.96	28	803.60	51	545.38	74	2329.45	97	1046.50
6	848.56	29	803.60	52	545.38	75	1169.53	98	1046.50
7	848.56	30	590.82	53	545.38	76	649.94	99	1046.61
8	848.56	31	590.82	54	545.38	77	951.04	100	1046.70
9	848.14	32	590.82	55	252.69	78	590.82	101	1046.68
10	791.33	33	590.82	56	691.36	79	590.82	102	1046.58
11	608.80	34	590.82	57	544.18	80	590.82	103	1046.50
12	537.30	35	590.82	58	544.18	81	590.82	104	1046.50
13	432.50	36	590.82	59	739.02	82	1181.54	105	1046.50
14	371.56	37	590.82	60	1127.23	83	1076.40	106	1046.50
15	310.64	38	590.82	61	984.50	84	1076.40	107	1046.50
16	329.87	39	590.82	62	703.48	85	1181.54	108/1	2954.40
17	590.82	40	589.78	63	516.17	86	590.82	108/2	1043.95
18	590.82	41	695.35	64	318.26	87	590.82	108/3	803.25
19	590.82	42	590.82	65	342.85	88	590.82	108/4	840.31
20	590.82	43	590.82	66	404.59	89	590.82	108/5	1468.93



## એમેનીટીઝ



એન્ટ્રી ગેટ



કોમન પ્લોટ



કમ્પાઉન્ડ વોલ



ડ્રેનેજ લાઇન



સ્ટ્રીટ લાઇટ



સિમેન્ટ રોડ



SECURITY

સિક્યુરિટી ઝૂમ

## Neighbourhood of prestigious industries

- GOLD COIN PVT. LTD.
- TOP CRANE PVT. LTD.
- CMK PVT. LTD.
- FIBER TECH COMPOSITE PVT. LTD.
- RP HYGIENE LLP.
- SANGITTA PRINTECH PVT. LTD.
- DADAJI LIFESCIENCE PVT. LTD.
- SHREE ASHUTOSH INDUSTRIES PVT. LTD.
- STEAM POWER ENERTECH PVT. LTD.

## Industry Friendly



Automobile Industry



Textile Industry



Fibre Industry



Electric Goods Industry



Agriculture Industry



Food Industry



Packaging Industry



Paper & Printing Industry



Footwear Industry



Cold Storage



Cable Industry



Metal & Chemical Industry



Furniture Fittings Industry




Warehouse

## A well-developed industrial ecosystem

એક વેલડેવેલોપ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ જેની નજીકમાં અવેલેબલ છે :


- સ્કીલ્ડ, સેમીસ્કીલ્ડ, અનસ્કીલ્ડ લેબર.
- મોટાભાગના ઉદ્યોગો માટે રિક્વાયર્ડ એવું રો-મટીરીયલ.
- લેબર માટે ટ્રાસન્પોર્ટેશન.




# The sheer might of Indian economy-be a contributor

“When India is emerging as the biggest economy in the world, everyone can see a better future for themselves in it.” - Honorable PM Shri Narendra Modi

આવનારા સમયમાં OECD (Organization for Economic Cooperation and Development) ના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્ર 6.3% ના દરે વિકાસ કરશે જ્યારે China 4.7% ના દરે વિકાસ પામવાની શક્યતા છે. આમ, વિશ્વની આર્થિક મહાસત્તાઓને છોડી ભારત આર્થિક મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે. CRISIL જેવી ક્રેડિટ સંસ્થાઓ પણ ભારતીય અર્થતંત્રનો ગ્રોથ અંદાજ 6.4% નો બાંધે છે. ભારતના કુલ GDPમાં મેનુફેક્ચરિંગ ઉદ્યોગનો હિસ્સો 17% છે અને આવનારી નીતિ મુજબ આવનાર 6 વર્ષમાં જ સરકાર આ હિસ્સો 21% સુધી પહોંચાડવા કટિબદ્ધ છે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારત કે Vocal for Global જેવા કાર્યક્રમો, G20 Summit અને Moon Mission ની સફળતા થકી ભારતની છબિ વિશ્વસ્તરે મહાસત્તા તરીકે ઉભરી છે. RK Group પણ વિકાસના આ મહાયજ્ઞમાં અને ભારતને વિશ્વસત્તા બનાવવાના મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે. આવો સાથે મળી ભારતને વિશ્વસત્તા બનાવીયે.



## લોકેશન મેપ



## નજીક

- પેટ્રોલ પંપ 7.9 KMS
- રેલ્વે સ્ટેશન 25.5 KMS
- પીપાવાવ પોર્ટ 176 KMS
- કંડલા પોર્ટ 215 KMS
- ન્યુ એરપોર્ટ 49 KMS
- મુન્દ્રા પોર્ટ 237 KMS

Note :  
 • Payments like service tax, stamp duty, VAT, GST, registration charges, maintenance deposit and as applicable to be borne by the purchaser. • In the interest of continuous development, the developer reserves all right to modify, eliminate or change the specification. • The brochure is not treated as a part of contract, it is only for the easy display of the project. This is for information only. • Transfer fees applicable as per the rules by developers. • Maintenance charges to be paid by the purchaser as per the rules & regulations by developers. • All rights reserved with developers. • Subject to Rajkot Jurisdiction.



CLICK HERE  
TO CONTACT



CLICK HERE  
FOR LOCATION



@ નારણકા, કોટડા-સાંગાણી રોડ, રાજકોટ.  
BOOKING CONTACT: 81000 46000